



HDZ-001-013107

Seat No. \_\_\_\_\_

**M. A. (Sem. I) (CBCS) Examination**

November / December – 2017

**Philosophy : ECT - 01**

*(Philo. of Yoga)*

*(Old Course)*

**Faculty Code : 001**

**Subject Code : 013107**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

સૂચના : જમણી બાજુના અંક પ્રશ્નના કુલ ગુણ સૂચવે છે.

|   |                                   |    |
|---|-----------------------------------|----|
| ૧ | યોગની વ્યાખ્યા અને ક્ષેત્ર તપાસો. | ૧૪ |
|   | અથવા                              |    |
| ૧ | યોગ તત્ત્વમીમાંસા ચર્ચો.          | ૧૪ |
| ૨ | સમાધિના પ્રકારો સમજાવો.           | ૧૪ |
|   | અથવા                              |    |
| ૨ | વૃત્તિના પ્રકારો ચર્ચો.           | ૧૪ |
| ૩ | અષ્ટાંગ યોગ સમજાવો.               | ૧૪ |
|   | અથવા                              |    |
| ૩ | યોગમાં વિભૂમતિ સમજાવો.            | ૧૪ |
| ૪ | ક્રિયા યોગનું સ્વરૂપ ચર્ચો.       | ૧૪ |
|   | અથવા                              |    |
| ૪ | કૈવલ્યનું સ્વરૂપ સમજાવો.          | ૧૪ |

- ૫ ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) ૧૪  
(અ) ચિત્તભૂમિઓ.  
(બ) ક્લેશના પ્રકારો.  
(ક) સંયમનું સ્વરૂપ.  
(ડ) પ્રત્યાહારનું સ્વરૂપ.

### ENGLISH VERSION

**Instruction :** Figures at right indicates full marks of the question.

- 1 Examine the definition and scope of Yoga. 14  
**OR**
- 1 Discuss Yoga ontology. 14
- 2 Explain the types of Samadhi. 14  
**OR**
- 2 Discuss the types of Vratti. 14
- 3 Explain Astang-Yoga. 14  
**OR**
- 3 Explain Vibuti in Yoga. 14
- 4 Discuss the nature of Kriya-Yoga. 14  
**OR**
- 4 Explain the nature of Kaivalya. 14
- 5 Write short notes : (any two) 14  
(a) Chittbhumis.  
(b) Types of Kleshas.  
(c) Nature of Sanyam.  
(d) Nature of Pratyahar.